

Moving Every Mile With A Smile

SYMBOL: MAHESHWARI ISIN: INE263W01010 DATED: 18.07.2025

To,
The Manager-Listing Department,
The National Stock Exchange of India Limited,

Exchange Plaza, NSE Building, Bandra Kurla Complex, Bandra East, Mumbai-400 051

Subject: Intimation of Newspaper Advertisement and Reminder Letter under IEPF Rules – Transfer of Shares and Unclaimed Dividend

Pursuant to Regulation 30 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time, we hereby enclose

- **a.** Copies of newspaper advertisements published in **Business Standard** (English language) and **Gujarat Guardian** (Gujarati language) on Friday, 18th July, 2025;
- **b.** Copy of reminder letter sent to concerned Shareholders whose dividend(s) are unclaimed for 7 consecutive years and whose shares are liable to be transferred to IEPF Authority of the notice to Equity Shareholders of the Company regarding transfer of equity shares of the Company to Investor Education and Protection Fund (IEPF) Account.

Pursuant to the provisions of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended, the Company has sent the above reminder letters to all concerned Shareholders.

You are requested to kindly take the above information on your record.

Thanking you,

Yours Truly,

For Maheshwari Logistics Limited

Gaurav Rajesh Jhunjhunwala

Company Secretary & Compliance Officer

Enclosure: As above

SUPPLIERS OF ALL TYPE OF COAL, COKE, LIGNITE, KRAFT PAPER & DUPLEX BOARD, FLEET OWNERS & TRANPORTS CONTRACTORS

MLL House, Shed No. A2-3/2, Opp. UPL, 1St Phase, GIDC, Vapi-396 195 (Guj.) Phone: +91 260 2431024 Fax: 2427024 E-mail: info@mlpl.biz Web: www.mlpl.biz CIN: L60232GJ2006PLC049224

Bureau's D-G calls speculation in certain sections of foreign media 'unfounded' and 'premature'



Wreckage of the Air India Boeing 787-8 Dreamliner plane placed outside Sardar Vallabhbhai Patel International Airport in Ahmedabad

DEEPAK PATEL New Delhi, 17 July

Speculation in sections of the foreign media regarding the cause of the Air India (A-I) flight AI171 crash is "unfounded" and "premature", G V G Yugandhar, directorgeneral of the Aircraft Accident Investigation Bureau (AAIB), said on Thursday

This is the first public statement by Yugandhar since the June 12 crash of A-I's Boeing 787-8 aircraf, which killed 241 of the 242 people on board.

Titled 'Appeal', his statement came hours after *The Wall Street Journal (WSJ)* published a report that pointed to Captain Sumeet Sabharwal turning off fuel switches moments before the crash.

Yugandhar on Thursday evening said: "It is essential to respect the sensitivity of the loss faced by family members of deceased passengers, crew of the aircraft, and other deceased persons on the

"It has come to our attention that certain sections of the international media are repeatedly attempting to draw conclusions through selective and unverified reporting. Such actions are irresponsible, especially while the investigation remains ongoing,"

The AAIB had released its preliminary

report on July 12, which revealed that fuel supply to both engines was cut off shortly after takeoff. The two fuel control switches were moved to the 'cutoff' position in quick

succession, and although they were turned

back on about 10 seconds later, the engines

had already flamed out. The purpose of the AAIB's investigation and preliminary report is to provide information about what happened. At this stage, it is too early to reach any definite conclusions," Yugandhar said on Thursday, urging the public and media to refrain from "spreading premature narratives that risk undermining the integrity of the investigative process'

He stressed that the AAIB was investigating the crash "rigorously and most prounder the Aircraft (Investigation of Accidents and Incidents) Rules, 2017, which govern India's obligations under international aviation protocols, notably the International Civi Aviation Organization's Annex 13. These rules lay down procedures for impartial, non-criminal investigations focused on safety improvement rather than blame.

Yugandhar also underlined AAIB's track record, noting that it had investigated 92 accidents and 111 serious incidents since its inception in 2012. He called the AI171 crash "the most devastating accident in recent aviation history".

Ctrl+Alt+Reboot: AI rewriting jobs, not ending them

A Naukri.com survey finds most Indian job seekers are more curious than anxious about AI

SURAIEET DAS GUPTA

New Delhi, 17 July

For those worried about losing their jobs to artificial intelligence (AI), here's something to cheer about. A survey by the country's largest job site, Naukri.com, Accounts & finance released on Thursday, shows that only one in three job seekers (33 per cent) across age groups fear job losses due to AI, so the majority do not.

Among fresher job seekers, one in three believes AI will create more jobs. In contrast, experienced professionals expect a balance — jobs created will likely match those lost.

The survey is based on responses from over 60,000 job seekers across eight cities and more than 20 industries. It also incorporates an opinion poll of recruiters and data from thousands of job postings on the Naukri platform.

Future of jobs

Segments that see new AI-based roles according to recruiters



contrasts with that of the US, where Gallup research shows that a majority (75 per cent)

job opportunities in the next decade. But there are areas of concern.

As many as 40 per cent of senior job seekers in the ₹15-lakh-plus salary band say they've felt a loss of creativity due to AI. This is more pronounced in creative industries such as advertising and mar-

keting, animation and VFX, film and music, and emerging tech. Also, 38 per cent of those earning ₹1 crore or more fear further job losses by

The Naukri.com survey busts several myths around AI's impact. For instance, only 13 per cent of recruiters believe AI will lead to job losses — a view that lines up with what job seekers think, particularly younger, entry-level candidates.

However, job roles are shifting. Between April and June this year, job postings for machine learning (ML) engineers India's more optimistic view of AI of professionals believe AI could reduce doubled compared to the same period last

year. Postings for search engineers rose 62 per cent, data scientists 30 per cent, and cybersecurity experts 28 per cent. On the other hand, roles in mobile app development, system administration, front-end development, and white-box testing have seen sharp declines.

The belief that AI/ML job growth is hype isn't supported by data. Naukri.com listed 35,000 AI/ML jobs between April and June this year — 38 per cent more than last year — while non-AI/ML job postings grew only 8 per cent. Of these, 1,500 AI/ML roles came from Tier-II cities like Indore, Coimbatore, and Kochi, among others.

AI skills also push up salaries considerably. Based on Naukri.com job data from April to June this year, the median salary for professionals with AI skills was 53 per cent higher than for those without. Beyond information technology, hot sectors for AI jobs include accounting, knowledge process outsourcing, and banking.



Zepto cofounders Kaivalya Vohra (left), Aadit Palicha

Avendus-Hurun Uth series: Zepto cofounders top the list

The inaugural edition of the Avendus Wealth - Hurun India Uth Series 2025 recognised 79 young leaders aged 30 and below who were making a significant impact across the Indian economy. The cofounders of the quickcommerce unicorn Zepto. Kaivalva Vohra (22) and Aadit Palicha (22), stand out as the youngest entrepreneurs of the year. Among women

leaders, OptraSCAN cofounder Devika Gholap (28) leads the list. In terms of cities, Mumbai reaffirms its dominance as India's financial capital, leading with 15 featured entrepreneurs.

With 8 alumni featured, BITS Pilani leads all undergraduate institutions. followed by IIT Roorkee and IIT Delhi with 6 each. **UDISHA SRIVASTAV** Top 5 youngest entrepreneurs in India

Name	Age	Company							
Kaivalya Vohra	22	Zepto							
Aadit Palicha	22	Zepto							
AVR Shree Smaran	22	AVR Swarna Mahal Jewellers							
Arjun Deshpande	22	Generic Aadhaar							
Shiva A Sankeshwar	23	Vijayanand Travels							

Top 5 youngest women entrepreneurs in India

Name	Age	Company
Devika Gholap	28	OptraSCAN
Devanshi Kejriwal	28	Skillmatics
Radhika Ambani	30	Encore Healthcare
Ananyashree Birla	30	Svatantra Microfin
Vrushali Prasade	30	Pixis

Top 5 industries represented

Industry	No. of entrants	Notable companies	
Software products & services	21	Perplexity, Zupee	
Consumer goods	12	Mrs Bector's Food Specialities	
Financial services	9	BharatPe, Svatantra Microfin	
Healthcare	8	Encore Healthcare, Cupid, OptraSCAN	
Aerospace & defence	7	Pixxel, Digantara	
Source: A	vendus-Hi	urun Uth Series 2025	

TECHDIGEST mybs.in/tech



Thomson 4K Mini **OD-LED TVs launched**

SPPL has launched the Thomson 4K Mini OD-LED TVs in India, available in 65-inch (₹61,999) and 75-inch (₹95,999) sizes via Flipkart. Touted as India's first TVs with dual builtin subwoofers, they offer Dolby Vision, Dolby Atmos, 108W sound, and run Google TV.

Meta Al's 'Imagine Me' now available in India

Meta has launched its AI-powered 'Imagine Me' feature in India, allowing users to generate stylised images of themselves in various settings via Meta AI, Instagram,

Messenger, and WhatsApp. It will initially be made available on Android, followed by an iOS rollout.



Registered Office: D-4 MIDC, Chikalthana, Chhatrapti Sambhailnagar - 431 006. Telephone: 91-240-6694444; Fax: 91-240-2489219 Global Headquarters: Wockhardt Towers, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400 051; CIN: L24230MH1999PLC120720

Email: investorrelations@wockhardt.com: Website: www.wockhardt.com

NOTICE OF ANNUAL GENERAL MEETING AND E-VOTING

Notice is hereby given that the 26th Annual General Meeting of the Members of the Company (the 'AGM') will be held on Friday, August 8, 2025 at 3:30 p.m. (IST) through Video Conferencing ('VC')/Other Audio Visual Means ('OAVM'), to transact the businesses set forth in the AGM notice dated May 29, 2025.

In accordance with the General Circular dated April 8, 2020, April 13, 2020, May 5, 2020 January 13, 2021, December 14, 2021, May 5, 2022, December 28 September 25, 2023 and September 19, 2024 issued by the Ministry of Corporate Affairs and Circulars dated May 12, 2020, January 15, 2021, May 13, 2022, January 5, 2023, October 7, 2023 and October 3, 2024 issued by the Securities and Exchange Board of India ('SEBI Circulars'), the Notice of AGM and Annual Report including the Audited Financial Statements for the Financial Year 2024-25 have been sent in electronic mode to Members whose email IDs are registered with the Company or the Depository Participant(s). The electronic dispatch of the Annual Report and the Notice of AGM to Members has been completed on July 16, 2025.

In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing the facility to all its Members (holding shares either in physical or in electronic form) to exercise their vote on the resolutions proposed to be considered at the AGM by electronic means through e-voting platform ('remote e-voting') provided by National Securities Depository Limited ('NSDL'). Further, it is also notified to the Members that:

a) The remote e-voting period begins on Tuesday, August 5. 2025 at 09.00 AM (IST) and ends on Thursday, August 7, 2025 at 05.00 PM (IST). During this period. Members of the Company holding shares either in physical or electronic form, as on the Records Date/cut-off date i.e. Friday, August 1, 2025 may cast their vote through remote e-voting.

b) A person, whose name appears in the Register of Members/ Beneficial Owners as on the cut-off date i.e. Friday, August 1, 2025 will be entitled to vote through remote e-voting or e-voting during the AGM. The voting rights of Shareholders shall be in proportion to the number of shares of the Company held by them as on the cut-off date.

The remote e-voting shall not be allowed beyond 05.00 PM (IST) on Thursday, August 7, 2025.

d) The Annual Report for the Financial Year ended March 31, 2025 and the Notice of AGM are also available on the website of the Company www.wockhardt.com. The Notice of AGM is also available on the website of NSDL at www.evoting.nsdl.com, on the website of BSE Limited www.bseindia.com and National Stock Exchange of India Limited www.nseindia.com, where the equity shares of the Company are listed.

Any person, who becomes a Member of the Company after despatch of the Notice of AGM and holds shares as on the cut-off date i.e. August 1, 2025, may obtain Login ID and Password for e-voting by sending a request to evoting@nsdl.co.in and if a Member is already registered with NSDL for remote e-voting, then he can use his existing User ID and Password for casting the vote through remote e-voting. For detailed instructions for remote e-voting, please

The Members who cast their vote through remote e-voting shall be eligible to attend the AGM, but shall not be allowed to cast their vote again at the AGM. The Members who have not cast their vote by remote e-voting shall be eligible to attend the AGM and cast their vote during the AGM.

In case of any queries/ grievances related to remote e-voting, the Members may refer to Frequently Asked Questions ('FAQs') and e-voting user manual available at the Downloads section of www.evoting.nsdl.com or write to Ms. Pallavi Mhatre at evoting@nsdl.co.in or call on 022-4886 7000.

By Order of the Board of Directors For Wockhardt Limited

Rashmi Mamtura Place: Mumbai Date: July 16, 2025 Company Secretary

MAHESHWARI LOGISTICS LIMITED

CIN: L60232GJ2006PLC049224 MLL House, Shed No. A2-3/2, Opp. UPL 1st Phase, GIDC Vapi, Valsad, Gujarat-396195 Contact: 0260-2431024, Email: info@mlpl.biz, Website: www.mlpl.biz

NOTICE

(FOR THE ATTENTION OF THE EQUITY SHAREHOLDERS OF THE COMPANY) Transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund ('IEPF') Demat Account

This Notice is hereby given to equity shareholders of the Company pursuant to the provision of Section 124(6) of the Companies Act, 2013 ("the Act") read with Rules 6(3) of the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 201 ('the Rules'), as amended from time to time. The Act and the Rules, amongst other matters, mandates the transfer of shares to the IEP

Authority in respect of which dividends have remained unpaid or unclaimed for a consecutive period of seven years or more. Further, the unpaid/unclaimed dividend amounts are also require to be transferred to the IEPF.

However, shares shall not be transferred to the IEPF Demat Account if:

There exists a specific order of a Court, Tribunal, or other statutory authority restraining The shares are pledged or hypothecated in accordance with the provisions of th

As provided under the Rules, the Company has sent individual communication to the concerne shareholders whose shares are becoming due to be transferred to the account of IEPF Authority

pursuant to provisions of Companies Act, 2013, at their latest available registered address wit Further in accordance with the Rules, the Company has also uploaded complete details of the concerned shareholder(s) whose shares are due for transfer to IEPF Demat Account including the names, Folio No./DP Id & Client Id of such shareholder, number of shares and amount of unclaimed dividend for seven consecutive years on its website at https://www.mlpl.biz/ shareholders-information.html. Such disclosure on the Company's website shall be treated

as adequate notice in respect of issuance of new share certificate(s) or corporate action, as th case may be, for the purpose of transferring shares to the IEPE Demat Account. Shareholders whose names appear in the list uploaded on the Company's website are requested

to approach the Company or its Registrar and Transfer Agent, M/s. Bigshare Services Private imited, on or before October 22, 2025, by submitting the following duly completed documents Investor Service Request Form ISR-1

Form ISR-2

Form ISR-3 (Opt-out of Nomination)

Along with supporting documents, including an original cancelled cheque bearing the name c the account holder (in case of physical shareholding). The Investor Service Request Forms can be downloaded from the RTA's website at

https://www.bigshareonline.com-->Services-->Investor Resources-->Downloads--Forms → Formats for KYC. n case the dividends are not claimed by 22nd October, 2025, the Company would initiat necessary action for transfer of unclaimed dividends and shares held by the concerned

hareholders in favour of the IEPF Authority without any further notice, in accordance with the - For shares held in physical form - New share certificate(s) in lieu of the original share certificate(s) will be issued and transferred in favour of the IEPF Authority on completion or

ecessary formalities. The original share certificate(s) which stand registered in the name of the shareholder(s) will be deemed cancelled and non-negotiable - For shares held in demat form - The Company shall inform the Depositories to execute the

corporate action and debit the shares lying in the demat account of the shareholder(s) and transfer such shares in demat account of IEPF Authority As per SEBI norms, outstanding payments will be credited directly to the bank account if the folio is KYC Compliant. Payment can be made to shareholders holding shares in physical

form if the folio is KYC compliant. The concerned shareholder(s) are further informed that all future benefits arising on such share would also be transferred to the IEPF Authority.

Please note that no claim shall lie against the Company in respect of unclaimed divider amount and equity shares transferred to the IEPF Authority pursuant to the said Rules The Shareholder(s) may note that in the event of transfer of their unclaimed dividends an shares to the IEPF Demat Account (including all benefits accruing on such shares, if any), the concerned shareholder(s) are entitled to claim the same from the IEPF Authority by submitting an online application in the prescribed **e-Form IEPF-5**, available on the website **www.iepf.gov.ir** and sending a physical copy of the same, duly signed (as per the specimen signature recorde with the Company) to the Company at its Registered Office along with the requisite document

Company at https://www.mlpl.biz/shareholders-information.html. hey may contact the Company's Registrar and Transfer Agents at:

enumerated in e-Form IEPF- 5. The link to e-Form IEPF-5 is available on the website of the

Bigshare Services Private Limited Address: Office No. S6-2, 6th Floor, Pinnacle Business Park, next to Ahura Centre, Mahakali Caves Road, Andheri (East) Mumbai- 400093, Maharashtra, India,

Place: Vapi

Date: July 18, 2025

Telephone: 022-62638200, Email: lawoo@bigshareonline.com / investor@bigshareonline.com. Website: https://www.bigshareonline.com.

For Maheshwari Logistics Limited Gaurav Rajesh Jhunjhunwala Company Secretary & Compliance Officer



Regd. Office: 'Trishul', 3rd floor, Opp. Samartheshwar Temple, Near Law Garden, Ellisbridge, Ahmedabad - 380 006. Corporate Office: Axis Bank Limited, Axis House, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400 025. CIN: L65110GJ1993PLC020769, Phone: 079-66306161, Email: shareholders@axisbank.com

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2025

	Axis	Bank (Standa	lone)	Axis Bank (Consolidated)				
PARTICULARS	FOR THE QUARTER ENDED 30.06.2025	FOR THE YEAR ENDED 31.03.2025	FOR THE QUARTER ENDED 30.06.2024	FOR THE QUARTER ENDED 30.06.2025	FOR THE YEAR ENDED 31.03.2025	FOR THE QUARTER ENDED 30.06.2024		
Total income from operations	38,321.57	1,47,934.10	35,844.22	40,401.00	1,55,916.86	37,795.88		
Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	7,567.50	34,346.58	8,066.96	8,179.70	36,722.16	8,643.34		
Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	7,567.50	34,346.58	8,066.96	8,179.70	36,722.16	8,643.34		
Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	5,806.14	26,373.48	6,034.64	6,243.72	28,055.11	6,436.43		
Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	Refer note 1							
Paid-up equity share capital (Face value ₹2/- per share)	620.24	619.47	618.05	620.24	619.47	618.05		
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	1,77,997.47 (As on 31st March, 2025)	1,77,997,47 (As on 31st March, 2025)	1,49,617.69 (As on 31st March, 2024)	1,85,433.36 (As on 31st March, 2025)	1,85,433.36 (As on 31st March, 2025)	1,55,511.72 (As on 31st March, 2024)		
Earnings per Share (Face value ₹2/- per share) (for continuing and discontinued operations) (₹) (not annualised)								
- Basic - Diluted	18.73 18.64	85.28 84.77	19.54 19.40	20.15 20.04	90.72 90.18	20.84 20.69		
Securities Premium Account	53,635.05	53,315.56	52,771.44					
Net Worth	1,78,920.70	1,73,051.25	1,51,825.45					
Outstanding Debts	1,80,970.81	1,84,146.52	1,89,897.86					
Outstanding Redeemable Preference Shares	Nil	Nil	Nil					
Debt Equity Ratio	0.98	1.03	1.20					
Capital Redemption Reserve	Nil	Nil	Nil					
Debenture Redemption Reserve	Nil	Nil	Nil					

- 1. Information relating to Total Comprehensive Income and Other Comprehensive Income is not furnished as Ind AS is not yet
- 2. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the website of the Bank (www.axisbank.com) and on the Stock Exchange websites (www.nseindia.com and www.bseindia.com).
- 3. Previous period figures have been regrouped and reclassified, where necessary, to make them comparable with current period figures.

For and on behalf of the Board

AMITABH CHAUDHRY

MD & CEO

Place: Mumbai Date: 17th July, 2025

www.axisbank.com















થયો છે. શ્રુત સમંદર 🥻

અગાધ છે. એની ઊંડાઈ

માપવા માટે ચર્મચક્ષુ નહિં

પણ દિવ્યચક્ષુ જોઈશે.

અલ્પ બુદ્ધિવાળાઓ આ

શ્રુતસાગરમાં કૂદકો મારી

નામનો ગ્રંથ આચારમાર્ગનો

શકતા નથી. ધર્મબિંદુ 🎆

સમૃદ્ધિને ભલે ઉપકારી માને પણ ધર્મ,

ઉપકારી માનવાનું ભૂલે નહીં.

ઉમરપાડાની

ખાઇ આપઘાત

ટૂંકાવ્યું હતું. ગંગાબેન વનસિંગભાઈ વસાવાએ આ ઘટનાની ફરિયાદ

નોંધાવી છે. ઉમરપાડા પોલીસ

આત્મહત્યા પાછળનું કારણ હજુ

સુધી જાણવા મળ્યું નથી.

આપઘાત કરી લીધો હતો.

બૌદ્ધ ધર્મના બે વિદ્વાન જ્ઞાનગુપ્ત

વાદળોથી ઘેરાઈ ગયું.

પ્રચંડ આંધીના કારણે

સામાન હોય તે સમુદ્રમાં

પાસે હસ્તલિખિત બૌદ્ધ

જે વહાણના કપ્તાન હુકન કર્યો કે ''જેમની પાસે ભારે.

પૂર્વના કાળમાં નાલંદા અને પાછો ફર્યો ત્યારે પોતાની સાથે બૌહ

(તસવીર : ચંદ્રકાંત સોલંકી) વહાણ અચાનક આકાશના

સ્થિત તક્ષશિલા જેવી સમૃદ્ધ વિદ્યાપીઠો ધર્મના કેટલાય હસ્તલિખિત ગ્રંથો

ગોહરબાગ જૈન સંઘ બિલીમોરામાં હિંદુસ્તાનમાં હતી. આ જ્ઞાનનો વૈભવ લઈ ગયો. બંગાળના ઉપસાગરથી તે

જણાવ્યું હતું કે, ધર્મનો આવિષ્કાર દેશોમાંથી જ્ઞાનનો વારસો મેળવવા અને ત્યાગરાજ તેને વિદાય આપવા

જીવો પ્રત્યેની અસીમ કરૂણામાંથી માટે આપણા દેશમાં જિજ્ઞાસુઓ તેની સાથે વહાણમાં જઈ રહ્યા હતા

ત્ર્રંથ છે. અમૃત-સાગરનું સેમ્પલ છે. આવતા. દેશ-વિદેશની સતર ધર્મગ્રંથનું પોટલું હતું. તે ફેંકવા તૈયાર

જ્ઞાનાનંદની પાસે વિષયાનંદ તુચ્છ ભાષાઓના જાણકારી જંબુવિજયજી થયો ત્યારે એ જોઈને જ્ઞાનગુપ્ત અને

છે. જેઓ જ્ઞાનરૂપી સમુદ્રમાં ડૂબકી મહારાજ પાસે જ્ઞાનધનની પ્રાપ્તિ ત્યાગરાજે ના પાડી. તેમને કહ્યું આ

મારે છે તેની સુખાનુભૂતિ શબ્દાતીત માટે ફોરેનર્સો મોટી સંખ્યામાં જ્ઞાનનો અમૂલ્ય ખજાનો છે તેને તમે

છે. આજનાં ગૃહસ્થો ધન, માન અને આવતા. ચીનનો પ્રવાસી હ્યુએનસંગ ન ફેંકો તેને બદલે અમે બંને સમુદ્રમાં

શુભહ સંકુલ ખાતે પંન્યાસપ્રવર હિન્દુસ્તાનની પાસે હતો તે કદાચ ચીન જઈ રહ્યો હતો

પદ્મદર્શનવિજયજીએ ધર્મસભા સમક્ષ કોઈ રાષ્ટ્રની પાસે નહોતો. અન્ય

રાજપીપળામાં ધારાસભ્ય ચૈતર વસાવાની જેલમુક્તિની માંગ સાથે મહારેલી

સાગબારા તા.૧૭ ચૈતર વસાવાને જેલમુક્ત કરવા આદમી પાર્ટી (AAP) એ કાર્યકર્તાઓ, ખેંચવા તૈયાર છે. જોકે. ચૈતર વસાવાના આદિવાસી નેતા અને ધારાસભ્ય માટે આજે રાજપીપળા ખાતે આમ તેમના સમર્થકો અને ચૈતર વસાવાની સમર્થકોએ આ દરખાસ્તને સ્પષ્ટપણે નકારી



માહેશ્વરી લોજિસ્ટીક્સ લિમીટેડ

સરનામુ : એમએલએલ હાઉસ,શેડ નં.એ-૨-૩/૨,ચુપીએલની સામે,ફર્સ્ટ ફેઝ,જીઆઈડીસી,વાપી વલસાડ,ગુજરાત - ૩૯૬૧૯૫ સંપર્ક : ૦૨૬૦-૨૪૩૧૦૨૪,ઇમેલ : info@mlpl.biz/cs@mlpl.biz વેબસાઇટ : www.mlpl.biz નોટીસ

(કંપનીના ઈક્વિટીશેરહોલ્ડર્સના ધ્યાને લાવવા અંગે) કંપનીના ઇક્વિટી શેર્સ ઇન્વેસ્ટર એજયુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઈઈપીએફ) ડીમેટ એકાઉન્ટને તબદીલ કરવા બાબત

આ નોટીસ કંપનીઝ એકટ .2093 (દી એક્ટના ખંડ ૧૨૪૮૬) ની સાથે ઈન્વેસ્ટર એજચકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (એકાઉન્ટીંગ,ઓડિટ,ટ્રાન્સફર એન્ડ રીફંડ) રૂલ્સ,રેંબ્૧૬, ગા રૂલ દ્(૩) સુધારા મુજબ (' ધ રૂલ્સ ') ધ રૂલ્સ જે મિનિસ્ટ્રી ઓફ્ કોર્પોરેટ અફેર્સ દ્વારા સમયાંતરે જાહેર થાય છે એને વંચાણે લેતા પ્રકાશિત કરવામાં આવી છે.

એક્ટ અને રૂલ્સ તથા અન્ય બાબતો મુજબ જે શેર્સ ના ડીવિડન્ડ માટે સતત સાત વર્ષથી દાવો કરવામાં ન આવ્યો હોય એ આઈઈપીએફ ઓથોરિટીના નામે તબદીલ કરવા ફરજિયાતબન્ય છે.વધુમાં નહીં ચુક્વાચેલા/ દાવો નહીં કરાચેલા ડીવિડન્ડની ૨કમ પણ આઈઈપીએફ વે તબદીલ કરવા જેંગ્રરી બને છે.

બેકે એવા શેર્સ જે આઈઈપીએફ ડીમેટ એકાઉન્ટમાં તબદીલ નહીં થઈ શકે જો : ओ डोई अहाबत,ट्रीण्युनब डे अन्य डानूनी सत्ताधिडारीना तजहीबी अटडाववान

આદેશ કરવામાં આવ્યા હોય, અથવા

ડીપોઝટરીઝ એક્ટ,૧૯૯૬ની જોગવાઈમુજબ શેર્સ ગીરો મુકાયેલા હોય. આઈઈપીએફ રૂલ્સ હેઠળની જરૂરીયાતોને ધ્યાને લેતા કંપનીએ સંબંધિત શેર હોલ્ડર્સને વ્યક્તિગત રીતે જાણ કરી એમના શેર્સકંપનીઝ એક્ટ ,૨૦૧૩ ની જોગવાઈ મુજબઆઈઈપીએફ ઓથોરિટીના નામે તબદીલ કરવા પાત્ર છે તેમના છેલ્લા રજિસ્ટર્ડ સરનામાં ઉપર જાણ કરી

વધુમાં રૂલ્સને અનુસરીને કંપનીએ જેમના શેર્સ આઈઈપીએફ ડીમેટ એકાઉન્ટમાં તબદીલ કરવા પાત્ર હોય એવા શેર હોલ્ડર્સના નામ,ફોલિયો નં./ડીપી આઈડી અને ક્લાયન્ટ આઈડી શેર હોલ્ડરના નામ અને શેરની સંખ્યા તથા સતત છેલ્લા સાત વર્ષથી દાવો નહીં કરાચેલા ડીવિડન્ડની રકમ ની યાદીની જાણકારી પણ કંપનીની વેબસાઈટ https://www.mlpl. piz/shareholders-information.html ઉપ૨ અપલોડ કરી છે. કંપની દ્વારા વેબસાઈટ ઉપર કરવામાં આવેલી આ જાહેરાતને નવા શેર સર્ટીફિકેટસ જારી કરવા માટેની અથવા કોર્પોરેટ પગલાની નોટીસ ગણવી જે આઈઈપીએફ ડીમેટ એકાઉન્ટમાં તબદીલ કરવા માટેની છે. જે શેરહોલ્ડર્સના નામ કંપનીની વેબસાઈટ ઉપરની યાદીમાં હોય તેમણે કંપનીનો અથવ 2જિસ્ટ્રા૨ એન્ડ ટ્રાન્સફ૨ એજન્ટ મે.બિગશે૨ સર્વિસીઝ પ્રાઈવેટ લિમીટેડનો સંપર્ક **તા.૨૨મી ઓક્ટોબર,૨૦૨૫** અથવા એ પહેલા નીચે જણાવેલા દસ્તાવેજો સાથે કરવા વિનંતી છે:

• ઈન્વેસ્ટર સર્વિસ રીક્વેસ્ટ ફોર્મ આઈએસઆર-૧

• ફોર્મ આઈએસઆ૨-૨

🖢 ફોર્મ આઈએસઆ૨-૧૩ (નોમિનેશન ફોર્મ)

 ਤੀਸ ਆਈਐ਼ਲਾਵ-3 (ਆਪਣ ਆਉਣ ਗ੍ਰੀਮਿਕੇशਰ) જેની સાથે જરૂરી દસ્તાવેજો જેમાં વાસ્તવિક શેર હોલ્ડર હોય તો તેના નામવાળા મૂળ રદ

ઈન્વેસ્ટર સર્વિસ રીકવેસ્ટ ફોર્મ આરટીએની વેબ સાઈટ ઉપરથી ડાઉનલોડ કરી શકારશે : https://www.bigshareonline.com→Services→Investor→Resources→Dow nloads→forms→Formats for KYC

જો રરમી ઓક્ટોબર,૨૦૨૫ સુધી કોઈ ડીવિડન્ડ ક્લેઈમ ન કરાયું હોય તો કંપની એવ શેર ઠોલ્ડર્સના શેર્સ આઈઈપીએફ ઓથોરિટીના નામે તબદીલ કરવાના પગલા કોઈ પણ જાતની નોટીસ આપ્ય

વેના શરૂ કરશે જે નીચે મુજબના રૂલ્સ મુજબના હશે:

વાસ્તવિક રૂપમાં શેર ધરાવનારા માટે- નવા શેર સર્ટીફિકેટસ મૂળ શેર સર્ટીફિકેટ/સ ગા બદલામાં જારી કરી એને જરૂરી પ્રક્રિયા બાદ અને શેર હોલ્ડરના નામની ચકાસણી બાદ આઈઈપીએફ ઓથોરીટીને તબદીલ કરશે જેને પગલે મૂળ શેર સર્ટીફિકેટમાં નોંધાયેલું શેર કોલ્ડર(રો)નું નામ રદ ગણાશે અને એમાં કોઈ ફેરફાર નહીં થાય. **ડીમેટ રૂપમાં શેર ધારકો માટે :** કંપની ડીપોઝટરીને જાણ કરી કોર્પોરેટ પગલા લેવા અને

શેર હોલ્ડર(રો)ના ડીમેટ ખાતામાં રહેલા શેર્સ આઈઈપીએફ ઓથોરીટીને તબદીલ કરવા સેબીના નિચમો મુજબ બાકી ૨કમનું ચુક્વણું કેવાચસીમાં જણાવેલ બેંક ખાતામાં સીદ્યું જમા કરવામાં આવશે જે માત્ર વાસ્તવિક રૂપમાં શેર ધરાવનારા શેરધારકોના કેવાયસી દસ્તાવેજો

મુજબ હશે. . લાગતા વળગતા શેર હોલ્ડર્સને તેમના શેર્સ આઈઈપીએક ઓથોરીટીને તબદીલ થયા બાદ પણ મળનારા લાભો વિશે જાણ કરવામાં આવશે.

કૃપા કરી નોંધ લેશો કે ઉપરોક્ત નિયમો અનુસાર આઈઈપીએફ ઓથોરીટીને તબદીલ . થયલા દાવા વિનાની ડીવિડન્ડની ૨કમ અને ઈકિવટી શેર્સ સંબંધે કંપની સામે કોઈ દાવો

શેર ધારક(કો)એ નોંધ લેવી કે નહીં દાવો કરાચેલા ડીવિડન્ડસ અને શેર્સની આઈઈપીએક્ ડીમેટ એકાઉન્ટમાં તબદીલીના કિસ્સામાં (જો કોઈ હોય તો શેર ધારક તરીકેના લાભે સહિત) એવા શેર ધારકો આઇઇપીએફ ઓથોરીટી સમક્ષ તેમનો દાવો ઓનલાઇન અરજી કરીને કરી શકશે જે ઈ-ફોર્મ આઈઈપીએફ-૫ માં દર્શાવેલ છે અને વેબસાઈટ www.iepf gov.in ઉપર ઉપલબ્ધ છે.જેની નકલ (કંપનીના રેકોર્ડમાં નમુનાની સહી) સાથે મેળ ખાતી હોચ એવી સહી સાથે કંપનીની રજિસ્ટર્ડઓફિસ ઉપર ઈ-ફોર્મ આઇઈપીએફ-પ સાથે જરૂરી દસ્તાવેજો સાથે મોકલવી આઈઈપીએફ-૫ માટેના ઈ-ફોર્મની લીંક કંપનીની વેબસાઈટ

કોઈ પણ જાણકારી માટે શેરદારકોને કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટન

બિગશેર સર્વિસીઝ પ્રાઈવેટ લિમીટેડ,

सरनामुः ઓફ્સિ नं.એસ૬-૨, છઠ્ઠા માળે, પિનાકલ બિઝનેસ પાર્ક, અહુરા સેન્ટરર્ન ાજુમાં, મહાકાલી કેવ્સ રોડ, અંધેરી(પૂર્વ) મુંબઈ-૪૦૦૦૯૩ , મહારાષ્ટ્ર ,ભારત **हेलिङ्गोजः**०२२-६२६३८२००

វអੇલៈ lawoo@bigshareonline.com/investor@bigshareonline.com

વતિ માહેશ્વરી લોજિસ્ટિક્સ લિમીટેડ

કંપની સેક્રેટરી અને કોમ્પ્લાયન્સ ઓફિસર

ગૌરવ રાજેશ ઝુનઝુનવાલા

(નોડલ ઓક્સિર)

સ્થળ : વાપી તારીખઃ ૧૮ જુલાઈ,૨૦૨૫

હીરો હાઉસિંગ ફાઈનાન્સ લિમીટેડ

કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે) [પરીશિષ્ટ ૪ સાથે વંચાણે લેતા સિક્યુરિટો ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ રૂલ્સ ૨૦૦૨ના રૂલ ૮(૧)]

ઝાથી નીચે સહી કરનાર આથી નીચે સહી કરનાર હીરો હાઉસિંગ ફાઈનાન્સ લિમીટેડ(એચએચએફએલ) ઝધિફતઅધિકારીનેસિકયુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટસ એન્ ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ ના ખંડ ૧૩ (૧૨) અને સિક્યુરિટી ઇન્ટરેસ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ના રૂલ ૩ને વંચાણે લીધા બાદ મળેલા અધિકારો મુજબ નીચે જણાવેલ દેવાદાર (રો)ને તેમના છેલ્લા જાણીતા સરનામે કીમાન્ડ નોદીસ મોકલવામાં આવી હતી અને નોદીસ નીચે જણાવેલ બાકી લેણી રકમ નોદીસ મળ્યાના ૬૦ દિવસમાં ચુકવી દેવા જણાવવામાં આવ્યું હતું. દેવાદાર રકમ ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદારને ખાસ તથા બહેર બનતાને આ નીટીસથે જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે નીચે જણાવેલી મિલકતોનો કબબો કથિત એકટના ખંડ 93(૪ અને કથિત ૩લ્સના ૩લ ૮ હેઠળ પ્રાપ્ત અધિકારો હેઠળ લીધો છે.

દેવાદારને ખાસ તથા જાહેર જનતાને આથી ચેતવણી આપવામા આવે છે કે આ મિલકતો હવેથી હીર હાઉસિંગ કાઈનાન્સ લિ.ના બાકી લેણી રકમ અને વ્યાજ તથા દંડાત્મક વ્યાજ ખર્ચ અને કિંમત તેની સાર દર્શાવેલી તારીખથી તાબા હેઠળ હોઈ એનો કોઈપણ રીતે સોદો કરી શકાશે નહીં.

આથી કથિત એક્ટના ખંડ ૧૩ના પેટા ખંડ (૮) હેઠળની જોગવાઈ તરફ દેવાદારનું ધ્યાન દોરવામ

આવે છે કે તમની પાસે ગીરો મિલક્ત છોડાવવાનો હજુ સમય છે. लोन ખાતા हेवाहा२(शे)/ डांनूनी वारसहा२(शे)/ इंभान्ड नोशेसनी वारीण नंज२ डांनूनी प्रतिनिधी(भो) ना नाम अर्थित जारी उस्मान्ड नोशेस अप्रेर्धन अर्थे कि

	, , ,	गुन्तज जाडा स्डम	सारावर)				
23000032189, HHFAKWI AP	લાલબાબુ દિવાકરનાથ ઉપાધ્યાયના કાનૂની વારસદાર, શ્રીમતી અભિલાષા દેવી લાલબાબુ ઉપાધ્યાય	રૂ. ૧૪,૩૪,૬૨૨/-	૧૫-૦७-૨૦૨૫ (સાં કે તિક)				
સલામત સંપત્તિ/ સ્થાવર મિલકતો/ ગીરો મુકેલી મિલકતોનું વર્ણન : તમામ ખંડ કે અખંડિત ભાગની બનેલી સ્થાવર મિલકત બિનખેતી પ્લોટની જમીન મોર્જ દરાલ બ્લોક/સર્વે નં.૧૨૬ (જુનો કે.સ.નં.૨૧)							

કુલ ક્ષેત્રફળ ૧૧૮૬૬,૦૦ ચો.મી. શિવાંજલી રેસીડેન્સી પૈકી પ્લોટ નં.હર ક્ષેત્રફળ દ્રૅ૩.૮૦ ચો.મી.નં સાથે રોડની અવિભાજિત જમીનનો ૪૮.હ૧ ચો.મી. ભાગ મળી કુલ **ક્ષેત્રફળ ૧૧૨.૫૧ ચો.મી. સે** દઢાલ **રજિ.ઉ. અનેપેટા જિ.અંકલેશ્વર, જિ.ભરૂચ ગુજરાત ની સાથે ટાઈટલ દસ્તાવેજ મુજબર્ન કોમન સુવિધાઓ ચતુઃસીમા : પૂર્વે:** ળ્લોક/સર્વે નં.ની મિલકત, **પશ્ચિમે**: સોસાચટીનો રોડ, **ઉત્તરે** પ્લોટ નં.હપ, **દક્ષિણે:** પ્લોટ હ3

HHFSURLAP ગોપાલભાઇ હનુભાઇ રાઠોડ, ૦૫-૦૨- ૨૦૨૫ રૂ. ર૯,૨૪,૭૫૫/-2300004116 જશુબેન ગોપાલભાઇ રાઠોડ ૦૪-૦૨-૨૦૨૫ ના રોજ સલામત સંપત્તિ/સ્થાવર મિલકતો/ગીરો મુકેલી મિલકતોનું વર્ણન : તમામ ખંડ કે અખંડિત ભાગની બનેલી રથાવર મિલકત પ્લોટ નં.ર/૧૬૯(નાનો), ક્ષેત્રફળ ૧૨૦ ચો.મી. અને પ્લોટ નં.ર/૧૯૮(નાનો), ક્ષેત્રફળ ૧૪૦ ચો.મી. અને ૧૩૦.૦૬ ચો.મી. બિલ્ટઅપ એરિયા કુલ ક્ષેત્રફળ ૨૬૦.૦૦ ચો.મી. સુડા હાઉસિંગ પ્રોજેક્ટ (સચીન) સેક્ટર-૨,સાંદ ટામ રેસીડેન્સી પહેલા માળે માલિકી દોરણે કોમર્શિયલ રોલ 🗦 .સ.નં.૧૨૧/૨,૧૫૨ થી ૧૫૦, ૫૬/૯/૧ + ૨ + ૩+ ૪ રાત રદાંગલા વહેલાં ત્રાળ માલકા લારહ કામાચાલ રાહ રહાં..ગરમ,રમ રહા વચ્ચ, પણ ૧૨ ૧૩ છે. ૫મ ૬મ બર ૮મ ૯મવ , વપ૮, વપ૯, વર્ષ્ટ, વર્ષ્ટ, વર્ષ્ય (ગ્રાહ્મ) ત્રું, વપ૯, વર્ષ્ય વર્ષે વર્ષ્ય પૈકીનવજા પૈકીન પૈકીનવજપ પૈકી વજદ્ થી વજ૮,વપ૩ પૈકી વપ૪ થી વપદ્, વપ७ પૈકી વપ૮,વપ૯, વદ્દળ પૈકી અને વદ્દવ મોજે **ગા**મ

સચીન,પેટા જિ.ચોર્ચાસી,જિ.સુરત ગુજરાત ની સાથે ટાઇટલ દસ્તાવેજ મુજબની કોમન સુધિધાઓ ચતુઃસીમા ઉત્તરે : લાગુ દાદર, દક્ષિણેઃ લાગુ રોડ, પૂર્વે : લાગુ પ્લોટ નં.૧૯७ , પશ્ચિમેઃ લાગુ પ્લોટ નં.૧૯૯ સહી/- અધિકૃત અધિકાર્ર વતિ. હીરો હાઉસિંગ કાઈનાન્સ લિમીટેડ

<u>જાાહેર નોટીસ</u> વિ.જે.ભંડારી, સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત (દક્ષિણ) મજુરા, સુરતની કોર્ટમાં નં.જ.મ.પ્ર/એસ.આર.નં. ૯૯/૨૦૨૫ તા. ૧૫/૦૪/૨૦૨૫ વાદી :- બાલુભાઇ ભગવાનભાઇ વાણીયા, રહે.:- ૩૯૧, સંતોષનગર સોસાયટી, મારૂતિ ચોક,

રહે.:- ૩૯૧, સંતોષનગર સોસાયટી, મારૂતિ ચોક, તા. ૧૫/૦૪/૨૦૨૫ વરાછા રોડ,સુરત. વિરુધ્ધ પ્રતિવાદી : જન્મ-મરણ રજીસ્ટ્રારશ્રી, સુરત મહાનગરપાલિકા, સુરત. વિરુધ્ધ પ્રતિવાદી : જન્મ-મરણ રજીસ્ટ્રારશ્રી, સુરત મહાનગરપાલિકા, સુરત. વિષય:- જન્મ/મરણની નોંધણી અધિનિયમની કલમ ૧૩(૩) મુજબ જન્મ/મરણની નોંધણી કરાવવા બાબત. આથી આ જાહેર નોટીસથી લાગતા-વળગતા તમામ ઇસમોને જણાવવામાં આવે છે કે, સદર અરજીમાં અરજદારશ્રી બાલુભાઇ ભગવાનભાઇ વાણીયા, રહે.:- ૩૯૧,સંતોષનગર તા.૦૪/૦૬/૨૦૨૧ ના રોજ ૩૯૧,સંતોષનગર સોસાયટી, મારૂતિ ચોક,વરાછા રોડ, સુરત ખાતે થયેલ છે. અને તેઓના અવસાનની નોંધણી જે-તે વખતે કાયદાથી અજાણ હોઇ ભુલ અને શરતચૂકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંધણી જે-તે વખતે કાયદાથી અજાણ હોઇ ભુલ અને શરતચૂકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંધણી કરાવવા સામાવાળાને હુકમ કરવા સામે કોઇ પણ ઇસમને વાંધો કે તકરાર હોય તો અત્રની કોર્ટમાં નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૩૦ માં વાંધો રજૂ કરવો. જો વાંધો નહી આવે તો વાંધો નથી, તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતાં-વળગતાં ઇસમોએ નોંધ લેવી. આજ રોજ તા. ૧૫/૦૪/૨૦૨૫ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો.

(વિ.જે.ભંડારી) સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત (દક્ષિણ) મજુરા, સુરત.

પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, ચીખલી

વાદીઃ **શ્રી અશોક્કુમાર મોહનલાલ પટેલ** રહે. ૧૨-અ, અર્યોધયાનગર-૧બી, વિજલપોર, નવસારી. નં.એમએજી/જ.મ્.પ્ર./રજી.નં. ૩૫૪/૨૦૨ સબ ડીવીઝનલ મેજીસ્ટેટ ચીખલી કચેરી

સામાવાળાઃ તલાટી કમ મંત્રીશ્રી, વાઘરેચ, તા. ગણદેવી, જીલ્લો નવસારી જિ. નવસારી. તા. ૦૮/૦૭/૨૦૨૫ જન્મ-મરણ અદિાનિયમ - ૧૯૬૯ ની કલમ ૧૩ (૩) અન્વયે જન્મ / મરણની નોંધ કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજી અન્વયે નોટીશ

આથી લાગતા-વળગતા ઈસમોને જણાવવાનું કે, વાદીએ જન્મ-મરણ અધિનિયમ હેઠળ અરજી કરેલ છે કે, અરજદારશ્રી બશોકકુમાર મોહનલાલ પટેલ, રહે. ૧૨-ઍ, અયોધ્યાનગર-૧બી, વિજલપોર, જિ. નવસારીનાઓએ તેઓના કાકાદાદા સ્વ. મંગાભાઈ ભગવાનભાઈ પટેલનું મરણ તા. ૧૧-૦૬-૧૯૭૪ ના રોજ મોજેઃ વાઘરેચ, તા. ગણદેવી, જી. નવસારી ખાતે થયેલ અને તેમના મરણની નોંધંણી જે તે વખતે કાયદાથી અજાણ હોઈ ભૂલ અને શરતચુકથી કરાવવાની રહી ગયેલી છે. જેથી અત્રેની કોર્ટમાં અરજ દાખલ કરેલ છે. સદર મરણની નોંધણી બાર્બતે કોઈને વાંધો યા તકરાર હોય તો પોતે અથવા વકીલ મારફત સદરહું જાહેરાત પ્રસિધ્ધિની તારીખથી ૩૦ દિવસની અંદર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી ચીખલી, પ્રાંત કચેરી ચીખલી, જી. નવસારીની કચેરીએ વાંધા રજુ કરવાના રહેશે. જેની લાગતા-વળગતા કોર્ટનો સહી/- (મિતેશ પટેલ) સિક્કો સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ - ચીખ

બંને પત્નીઓ વર્ષાબેન અને શકુંતલાબેન કાઢી છે, તેમનું કહેવું છે કે ચૈતરભાઈ નિર્દીષ વસાવાની આગેવાની હેઠળ એક વિશાળ છે અને ક્યારેય માફી માંગશે નહીં. 'મહા રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય કલેક્ટર કચેરીને



આવેદન પત્ર સુપરત કરવા કલેક્ટર કચેરી પહોંચેલા આપના કાર્યકર્તાઓને આવેદન પત્ર સુપરત કરી ચૈતર વસાવાની પોલીસ દ્વારા ગેટ પર જ રોકી દેવામાં આવ્યા

હતા. આ અંગે કાર્યકર્તાઓએ પોલીસ પર ભાજપના ઈશારે એકતરફી કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો.

રેલી દરમિયાન ન્યાય આપો, ન્યાય આપો, સરકાર હમસે ડરતી હે પુલીસ કો આગે કરતી હે, 📕 ગાંધી લડે થે ગોરો સે હમ લડેંગે

ચૈતર્ વસાવા દશ દિવસથી વૂડોદ્રા જેલમાં, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોલીસ ઉપર ભાજપના ઈશારે એકતરફી કાર્યવાહી કરવાનો આરોપ મુક્યો

ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.

જાહેરમાં માફી માંગે તો તેઓ કેસ પાછો ન્યાય મળે તેવી અપીલ કરી હતી. તેમણે સંકેત પણ આપવામાં આવ્યો હતો.

તાત્કાલિક મુક્તિની માંગણી કરવાનો હતો. ચોરો સે, ઇન્કલાબ ઝિંદાબાદ, ચૈતરભાઈને જોકે, કલેક્ટર કચેરી ખાતે પોલીસ અને રિહા કરો, અને દિવાસી એકતા ઝિંદાબાદ કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાના પત્ની દ્વારા હુંકાર કરવામાં ચૈતર વસાવા છેલ્લા દશેક દિવસથી આવ્યો કે, ચૈતર વસાવા લોકો માટે સડકથી વડોદરા જેલમાં બંધ છે. 5 જુલાઈથી તેઓ સદન સુધી અવાજ ઉઠાવે છે અને નાના જેલવાસ ભોગવી રહ્યા છે. તેમની સામે એક બાળકો માટે પણ લડે છે, તેમને ખોટા કેસમાં બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સંજય ફસાવીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ વસાવા સાથેની ઉગ્ર બોલાચાલી દરમિયાન થઈ રહ્યો છે. લોકોમાં આ ખોટા જેલવાસ ગ્લાસ ફેંકવાના આરોપમાં FIR દાખલ અને કેસ અંગે ભારે આક્રોશ જોવા મળ્યો કરવામાં આવી હતી. આ કેસમાં કોટે તેમની હતો, કારણ કે જે ધારાસભ્ય લોકો માટે લડે મળે તો આવનારા દિવસોમાં જેલ જામીન અરજીઓ બે વખત નામંજુર કરી છે. છે તેને સરકાર દ્વારા દબાવી દેવામાં આવ્યું બીજી તરફ, સંજય વસાવાએ પત્ર લખીને છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એવી રજુઆત કરી હતી કે જો ચૈતર વસાવા _કલેક્ટરને આવેદન પત્ર આપ્યું અને ઝડપથી _ક્યારેય માફી નહીં માંગે તેવો સ્પષ્ટ

પાઇપલાઇન ખસંડવામાં આવી **સુરત :** સુરત શહેરમાંથી

ધરવામાં આવી હતી.

આમાદ, જબુસર તાલુકાના ગામોમા બિસ્માર માગોનુ સમારકાર હાથ ધરાતા ગ્રામજનોમાં ખુશહાલી વ્યાપી વાગરા, તા.૧૭ હસ્તક ના કેટલાક માર્ગ ભારે વરસાદ ને માઇને પેચવર્ક કરાતા આસપાસના

ના લોકોમાં ખુશી ની લહેર પ્રસરી જવા

(તસવીર : ઝફર ગડીમલ)

ભારતીય ઉદ્યોગસાહસિકો માટે મહત્વપૂર્શ

સમાચાર છે કે ઓસ્ટ્રેલિયન બિઝનેસ વિઝા

પ્રોગ્રામ ત્રણ વર્ષ પછી ફરીથી શરૂ કરવામાં

આવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય બિઝનેસ માઈગ્રેશન

માટ અક નવા યુગના શરૂઆત દશાવ છ. આ

અવસરે ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી–

ભારતની નંબર 1 બિઝનેસ માઈગ્રેશન

વિશ્વવ્યાપી વિસ્તરણ માટે સૌથી વિશ્વસનીય

પાર્ટનર તરીકે ઉભરી આવ્યું છે. ઓસ્ટ્રેલિયા,

યુએસએ અને યુએઈમાં સફળતાપૂર્વક 1,000થી

વધુ ક્લાઈન્ટ્સના બિઝનેસ સ્થાપિત કરવા માં

પનઃશરૂઆતને ભારતીય બિઝનેસ ઓનર્સ દ્વારા

ઓસ્ટ્રેલિયન વિઝા અરજીઓ પ્રોસેસ કરી છે, જે

ક્ષેત્રમાં તેની ઊંડી નિપુણતાનો પુરાવો આપે છે.

ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયન બિઝનેસ વિઝા પ્રોગ્રામની

ફિનિક્સે અત્યાર સુધી 300+ સફળ

કંપનીએ ન્યૂઝીલેન્ડ માટેના બિઝનેસ

કન્સ ૯ટન્સી – એ

પોતાના અમદાવાદ

ઉચ્ચપ્રોફાઇલ મીડિયા

ઇવેન્ટનું આયોજન કર્યું

સિંહની નેતૃત્વ હેઠળ

તેમણે મદદ કરી છે.

ઓફિસ

શરૂ કર્યાઃ 'ફિનિક્સ' કંપન<u>ી વિઝામાં</u> મદદ કરશે

લગભગ ૩૦૦ કરતા વધારે

વિઝા અરજી પ્રોસેસ કરીઃ

ફિનિક્સ એ ભારતીય ઉદ્યોગસાહસિકો માટે \$100,000 NZ (લગભગ 53 લાખ

માં લાગા તે તે માટે બિઝનેસ વૈશ્વિક સ્તરે વિસ્તરણ માટે વધુ એક તક CEO એમ.પી. માઇગ્રેશનની સેવા પણ આપશે આપે છે. વિઝા

પામી હતી.તંત્રનો ખાડા દૂર કરો ના અભિયાન ને પગલે વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

જંબુસર ડિવિઝન ના જિલ્લા કારણે બિસ્માર બનતા વાહન ચાલકો ને ગામડાના લોકો અને આ માર્ગ નો પંચાયત હસ્તક ના ગામોના રસ્તાઓનું હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો. ઉપયોગ કરતા વાહન ચાલકો ને રાહત ઝડપથી દુરસ્તીકરણ થતા ગ્રામ્ય વિસ્તાર રાજ્ય સરકારે બિસ્માર બનેલા માર્ગો નું થવા પામી હતી. જ્યારે જંબુસર તાલુકા દુરસ્તીકરણ કરવા તંત્રને જાણ કરી હતી. ના જંબુસર થી ભાણખેતર,સારોદ એપ્રોચ ર્જે બાબત ને ધ્યાને લઇ જંબુસર ડિવિઝન રોડ,ઉમરા થી ઉબેર,અને ઇસ્લામપુર થી ના ડેપ્યુટી ઈજનેર નિકુંજ શાહે તેમની કપૂરીયા રોડનું પણ પેચ વર્ક કરવામાં

બિસ્માર માર્ગોનું પેચવર્ક થતા વાહન ચાલકોને પડતી હાલાકીથી છુટકારો મળ્યો, કાયમી ધોરણે રસ્તાઓનું સમારકામ કરવા માગ

જંબુસર ડિવિઝન ના જિલ્લા પંચાયત સુઠોદરા તેમજ કરેણા થી વલણ ને જોડતા એવી આશા સેવી હતી.

માઈગ્રેશન

કરી–જે

નામ બદલેલ છે

મારી સગીર પુત્રીનું જૂનું નામ

પાસપોર્ટમાં **મનસ્વી અલ્પેશભાઇ**

પટેલ હતું જે બદલીને નવું નામ

મનસ્વી અલ્પેશ પટેલ રાખેલ

છે. જેની સર્વે નોંધ લેવી.

લિ. અલ્પેશ જયંતિભાઇ

પટેલ

સરનામું: ૩૦૫, સોળગાળા, કુંભારીયા, ચોર્ચાસી, સુરત-૩૯૫૦૧૦.

ઉદ્યોગસાહસિકોને

પછીનો રોકાણ ફક્ત

ભારતીય

ટીમ ને તૈનાત કરી બિસ્માર બનેલા આવતા સ્થાનિકોએ રાહત અનુભવી માર્ગો ને યુદ્ધ ના ધોરણે દુરસ્ત કરવાની હતી.આમોદ અને જંબુસર તાલુકાના કામગીરી હાથ ધરી હતી.આમોદ તાલુકા લોકોએ સરકારના આ અભિગમ ને સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી. ના ચકલાદ એપ્રોચ રોડ,આમોદ થી આવકાર્ય હતો અને કાયમી ધોરણે ચૌહાણ કેસની તપાસ કરી રહ્યા છે. પુરસા,વીંછીયાદ થી કોલવણા,તેલોદ થી રસ્તાઓનું સમારકામ કરવામાં આવે

ખાડીપુર નાથવા ભેદવાડ ખાડું પાસે નડતરરૂપ પાલિકાની પાણીની

પસાર થતી ખોડીમાં ગેરકાયદે તાણી દેવાયેલા સ્ટ્રકચર દુર કરવાની ઝુંબેશ દરમિયાન ભેદવાડ ખાડી પાસે મનપા દ્વારા લગાડવામાં આવેલી પાણીની લાઇન નડરરૂપ હોય મનપા દ્વારા પાઇપ લાઇન ખસેડવામાં આવી હતી. આ સાથે વિવિધ કલવર્ટ અને બ્રીજનું ડીમોલીશન મનપા દ્વારા કરવામાં આવ્યું હતું. સુરતીઓ માટે આફત બની જતા ખાડી પુર ને નાથવા માટે પાલિકા તત્રએ સતત ચોથા દિવસે ખાડીના પાણીને અવરોધતા દબાશ દુર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. પાલિકાન સર્વે દરમિયાન બહાર આવ્યું હતું કે, ભેદવાડ ખાડી પાસે પાઈપ કલવર્ટ પર મહાનગર પાલિકાના જ હાઇડ્રોલિક વિભાગ દ્વારા પાઇપ લાઈન નાખી દેવામાં આવી હતી તે લાઈન પાણી ને અવરોધતા હોવાથી તેને દુર કરવાની કામગીરી હાથ

જણાવ્યું કે તેમનો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે અને તેમને ન્યાય પર પૂરો ભરોસો છે. જો ઝડપથી ન્યાય નહીં ભરો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ચૈતર વસાવા

સુરતના વિવસો પાસેથી ત્રણ કરોડનો કાપડનો માલ યુવતીનો રહસ્યમય ખરીદી અમદાવાદના ૧૦ વેપારીએ છેતરપિંડી કરી સંજોગોમા ગળાફાંસો

વાંકલ, તા.૧૭ ઉમરપાડાની એક યુવતીએ રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઇ

નહી ચુકવી ઠગાઈ સુરત જિલ્લાના ઉમરપાડા કરતા ભોગ બનેલા તાલુકામાં એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. ઉમરગોટ ગામના સતકેવલ ફળિયામાં રહેતી 19 વર્ષીય રીંકલબેન વસાવાએ નોંધાવી છે. આંબાના ઝાડ પર ફાંસો ખાઈને

પરવત પાટીયા

આત્મહત્યા કરી લીધી છે. ઘટના માનસરોવર 🛮 ગંભીરભાઈ ગોવલાભાઈ વસાવાના સર્વે નંબર 24 વાળા ખેતરના છેડા પર બની હતી. રીંકલ આકાશભાઈ રણજીતભાઈ વસાવાની પત્ની અને રમેશભાઈ હોનીયાભાઈ વસાવાની દીકરી હતા. તેમણે આંબાના ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધીને જીવન

બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે નાલંદા કૂદી પડીએ છીએ. આમ બંને જણાએ જ્ઞાન અને સદબુદ્ધિ આપનારને પણ વિદ્યાપીઠમાં ઘણો સમય રહ્યો હતો. જ્ઞાનના માટે ખુદનું બલિદાન આપ્યું જયારે તે અભ્યાસ કરીને સ્વદેશ હતું. બીલીમોરામાં પદ્મદર્શનજીવિજયજીની ધર્મસભામાં ભક્તોએ રસપાન કર્યું

> સુરત, તા.૧૭ ક્રિપ્શા એજન્સીના નામે કાપડ દલાલીનં અમદાવાદના ૧૦ વેપારીઓએ કામકાજ કરતા ગીરીશ મોહનલાલ

ું મહેશ ગાંધી સહિત ચાર વેપારીઓનો થી ૩૧ માર્ચ સાઈમ ્ર ^{ફરિયાદ} વિશ્વાસ કેળવી ઉધારમાં માલ ખરીદી અમદાવાદના

હાઈટ્સ ખાતે રહેતા ૨૭ વર્ષીય ચૂકવી દેવાની બાહેધરી આપીને

સુરતના અલગ અલગ પાંચ વીવર્સો દેવજાનીએ શરૂઆતમાં કાપડનો પાસેથી કુલ રૂપિયા ૨.૯૮ કરોડનો વેપાર કરી તેનું સમયસર પેમેન્ટ કરી કાપડનો જથ્થો ખર<u>ીદ્યા બાદ પેમેન્ટ દીધું હતું.અને વિ</u>શ્વાસમાં લીધા હતા.

વેપારીઓએ

સારોલીમાં કાન્હા લાઇફસ્ટાઇલના જન્યુઆરા ૨૦૨૫ હાથ ઊંચા કરી દીધા પણ ૪૫ દિવસમાં કાપડના

મહેશકુમાર સંજયકુમાર ગાંધી મહેશ ગાંધીની પાસેથી અને બીજા સારોલીમાં રાધાક્રિષ્ણા લોજીસ્ટીક ચાર જેટલા વેપારીઓ મળીને પાંચ પાર્કમાં કાન્હા લાઈફ સ્ટાઈલ્સ ફર્મના વિવર્સની પાસેથી કુલ રૂ.૨.૯૮ કરોડનું નામે ભાગીદારીમાં કાપડનો વ્યવસાય _કાપડ ખરીદ કરીને તેના રૂપિયા નહિ ચૂકવીને ઠગાઈ કરી હોવા અંગેની મહેશકુમાર સાથે અમદાવાદમાં ફરિયાદ ડીસીબીમાં નોંધાઈ છે.

આરોપીઓના નામ

ગીરીશ મોહનદાસ દેવજાની (કાપડ દલાલ, અમદાવાદ) મયુર રાજેન્દ્ર છબલાણી (ડી.સી.ક્રિએશન, કાગડાપીઠ, અમદાવાદ) પ્રદિપ રાવલ (જય અર્બૂદા ક્રિએશન, કાલુપુર, અમદાવાદ) હિતેશહરેશકુમારવર્મા(ન્યુફ્રેશન ,સાદાણી ચેમ્બર્સ ,કાલુપુર ,અમદાવાદ) બ્રિજેશ મહેશકુમાર મકવાણા (એસ.વી.એસ ટેક્ષટાઈલ, અમદાવાદ) હરેશ મનોહર રામચંદાણી (સખી ઈન્ટરનેશનલ, અમદાવાદ) ચંદેર તે સ્ટાર ટ્રેડીંગ, કાગડાપીઠ, અમદાવાદનો માલિક

ગોરવ મકવાણા (વેદીકા ક્રિએશન, ફાઈન નગર, નિકોલ અમદાવાદ) મનીષકુમાર વિશનદાસ રતનાની (વીઆર ક્રિએશન, અમદાવાદ) અમીત મોહનલાલ ધનવાની (જય ક્રિપાલ ટેક્ષટાઈલ, અમદાવાદ)

<u>જાહેર નોટ્રીસ</u> વિ.જે.ભંડારી, સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત (દક્ષિણ) મજુરા, સુરતની કોર્ટમાં વાદી :- પુર્ણિમાબેન અનિલકુમાર ચેવલી નં.જ.મ.પ્ર/એસ.આર રહે્.:- ફર્લટ નં.ડી-૬૦૧,પાયોનીયર ડ્રીમ,ભૂીમરાડ રોડ, તા. ૦૭/૦૭/૨૦૨૫ વડોદ,સુરત. વર્ગદ,સુરત. પ્રતિવાદી : જન્મ-મરણ રજીસ્ટ્રારશ્રી, સુરત મહાનગરપાલિકા, સુરત. વિષય:-જન્મ/મરણની નોંધણી અધિનિયમની કલમ ૧૩(૩) મુજબ જન્મ/મરણની નોંધણી કરાવવા બાબત. આથી આ જાહેર નોંટીસથી લાગતા-વળગતા તમામ ઇસમોને જણાવવામાં આવે છે કે, સદર આથી આ જાહેર નોંટીસથી લાગતા-વળગતા તમામ ઇસમોને જણાવવામાં આવે છે કે, સદર

આથી આ જાહેર નોટીસથી લાગતા-વળગતા તમામ ઇસમોને જણાવવામાં આવે છે કે, સદર અરજીમાં અરજદારશ્રી પુર્ણિમાબેન અનિલકુમાર ચેવલી, રહે.:- ફલેટ નં. ડી-૬૦૧ પાયોનીયર ડ્રીમ,ભીમરાડ રોડ,વડોદ, સુરત ના દાદા રતીલાલ મગનલાલ જરીવાલાનું અવસાન તા,૧૩/૦૪/૨૦૦૭ ના રોજ ઘર નંબર-૩૬,મહાવીર નગર, ઉઘના મગદલ્લા રોડ, સુરત ખાતે થયેલ છે. અને તેઓના અવસાનની નોંઘણી જેન્તે વખતે કાયદાથી અજાણ હોઇ ભુલ અને શરતચૂકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંઘણી કરાવવા અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. તો સદર અવસાનની નોંઘણી કરાવવા સામાવાળાને હુકમ કરવા સામે કોઇ પણ ઇસમને વાંધો કે તકરાર હોય તો અત્રેની કોર્ટમાં નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૩૦ માં વાંધો રજૂ કરવો. જો વાંધો નહી આવે તો વાંધો નથી, તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતાં-વળગતાં ઇસમોએ નોંધ લેવી. આજ રોજ તા. ૦૭/૦૭/૨૦૨૫ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો.

કો તથા કાટના વિસ્તા કરા કરા (વિ.જે.ભંડારી) સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટી પ્રાંત (દક્ષિણ) મજુરા, સુરત.

વન વિભાગ સુરત TENDER NOTICE NUMBER: DCFSUR/TENDER/04/2025-26

સુરત વન વિભાગ, સુરત હેઠળની પ્રવાસન વિકાસ સમિતિ, જેતપુર-કેવડી દ્રારા સંચાલિત પ્રવાસન કેન્દ્ર જેતપુર-કેવડી, તા. માંડવી, જી. સુરતના યોગ્ય સંચાલન માટે મેનેજર-૧ની જરૂરીયાત હોય જેથી નીચે મુજબની શૈક્ષણીક લાયકાત તથા ૧ વર્ષ કે તેથી વધુનો અનુભવ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

કુલ જગ્યા | શૈક્ષણીક લાયકાત અ.નં. જગ્યાનું નામ મેનેજર (ઓપરેશન મેનેજમેન્ટ) oq MBA/Hotel Management ઉપરોક્ત જણાવેલ શૈક્ષણીક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ ૧૬/૦૭/૨૦૨૫ થી તારીખ ૨૫/૦૭/૨૦૨૫ દરમ્યાન નીચે આપેલ ક્યુ.આર.



ઉમેદવારોએ ફક્ત ક્યુ.આર. કોડ (QR Code) મારફતે અરજી ફોર્મ મેળવવાનું રહેશે, તથા ઉમેદવારોએ સદર ફોર્મની સંપૂર્ણ વિગતો ભરી ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોંટાડી ફોર્મ સાથે આધારકાર્ડ અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રો સામેલ રાખી તારીખ ૨૯/૦૭/૨૦૨૫ સુધીમાં નીચે આપેલા સરનામે રૂબરૂ, સ્પીડ પોસ્ટ, રજી. પોસ્ટ કે કુરીયર મારફતે મોકલી આપવાની રહેશે. તથા સમય મર્યાદા બહાર મળેલ અરજીઓ સ્વિકારવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવી. સરનામું: નાયબ વન સંરક્ષકની કચેરી સુરત વન વિભાગ, સુરત

ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ ડી-માર્ટની સામે અડાજણ,સુરત-૩૯૫૦૦૯. ફોન નં.: ૦૨૬૧-૨૭૩૩૮૨૫

ક્રમાંકઃ માહિતી-સુરત/પર૩/૨૦૨૫ પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, ચીખલી

સભ્ય સચિવ/પ્રમુખ/મંત્રી પ્રવાસન વિકાસ સમિતિ, જેતપુર-કેવડી, માંડવી જિ.સુરત

નં.એમએજી/જ.મ.પ્ર./૨જી.નં. ૩૫૬/૨૦૨

સબ ડીવીઝનલ મેજીસ્ટેટ ચીખલી કચેરી

વાદીઃ **શ્રી અશોકકુમાર મોહનલાલ પટેલ** રહે. ૧૨-અ, અયોધયાનગર-૧બી, વિજલપોર, નવસારી. **વિરૂદ્ધ**

સામાવાળાઃ તલાટી કમ મંત્રીશ્રી, વાઘરેચ, તા. ગણદેવી, જીલ્લો નવસારી

જિ. નવસારી. તા. ૦૮/૦૭/૨૦૨૫ જન્મ-મરણ અધિનિયમ - ૧૯૬૯ ની કલમ ૧૩ (૩) અન્વયે જન્મ / મરણની નોંધ કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજી અન્વયે નોટીશ

આથી લાગતા-વળગતા ઈસમોને જણાવવાનું કે, વાદીએ જન્મ-મરણ અધિનિયમ હેઠળ અરજી કરેલ છે કે, અરજદારશ્રી બશોકકુમાર મોહનલાલ પટેલ, રહે. ૧૨-ઍ, અયોધ્યાનગર-૧બી, વિજલપોર, જિ. નવસારીનાઓએ તેઓના દાદાશ્રી સ્વ. રણછોડભાઈ ભગવાનભાઈ પટેલનું મરણ તા. ૨૫-૦૮-૧૯૭૮ ના રોજ મોજેઃ વાઘરેચ, તા. ગણદેવી, જી. નવસારી ખાતે થયેલ અને તેમના મરણની નોંધર્ણી જે તે વખતે કાયદાથી અજાણ હોઈ ભૂલ અને શરતચુકથી કરાવવાની રહી ગયેલી છે. જેથી અત્રેની કોર્ટમાં અરજ દાખલ કરેલ છે. સદર મરણની નોંધણી બાબતે કોઈને વાંધો યા તકરાર હોય તો પોતે અથવા વકીલ મારફત સદરહું જાહેરાત પ્રસિધ્ધિની તારીખથી ૩૦ દિવસની અંદર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી ચીખલી, પ્રાંત કચેરી ચીખલી, જી. નવસારીની કચેરીએ વાંધા રજુ કરવાના રહેશે. જેની લાગતા-વળગતા કોર્ટનો સહી/- (મિતેશ પટેલ) સિક્કો સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ - ચીખલી

પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, ચીખલી

માત આઇકારા અન સબ ડાવાઝનલ મુજીસ્ટ્રેટની કરોરી, ચીખલી વાદી : શ્રી જયેશકુમાર નાનુભાઇ પટેલ, નં.એમએજી/જ.મ.મ./રજી.નં.૩૧૭/૨૦૨૫ રહે. વલોટી,નિશાળ ફળિયા,તા.ગણદેવી, જી.નવસારી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ચીખલી કચેરી, વિરુધ્ધ તાલુકા સેવા સદમ,બીજો માળ ચીખલી,જિ.નવસારી સામાવાળા : તલાટી કમ મંત્રીશ્રી, વલોટી, તા.ગણદેવી,જી.નવસારી તા.૨૫/૦૬/૨૦૨૫ જન્મ-મરણ અધિનિયમ-વરદ્ધની કલમ ૧૩/૩) અન્વયે જન્મ/મરણની નોંધ કરાવવા માટેનો હુકમ મેળવવા માટેનો અરજી અન્યયે નોટીસ આથી લાગતા વળગતા ઇસમોને જણાવવાનું કે, વાદીએ જન્મ-મરણ અધિનિયમ હેઠળ અરજી કરેલ છે કે, અરજદારશ્રી જયેશકુમાર નાનુભાઇ પટેલ, રહે. વલોટી,નિશાળ ફળિયા, તા.ગણદેવી, જી.નવસારીનાઓએ તેઓનો પોતાનો જન્મ તા.૧૦/૦૧/૧૯૬ના રોજ મોજે. વલોટી, તા.ગણદેવી, જી.નવસારીનાઓએ તેઓનો પોતાનો જન્મ તા.૧૦/૦૧/૧૯૬ના રોજ મોજે. વલોટી, તા.ગણદેવી, જી.નવસારીનાઓએ તેઓનો પોતાનો જન્મ તા.૧૦/૦૧/૧૯૬ના રોજ મોજે. વલોટી, તા.ગણદેવી, જી.નવસારીનાઓએ તેઓનો પોતાનો જન્મ તા.૧૦/૦૧/૧૯૬ના રોજ મોજે. વલોટી, તા.ગણદેવી, જી.નવસારીનાઓને સ્ટાર્થો અર્જાણ હોઇ ભૂલ અને શરતચુકથી કરાવવાની રહી ગયેલી છે. જેથી અત્રેની કોર્ટમાં અરજ દાખલ કરેલ છે. સદર જન્મની નોંધણી બાબતે કોઇને વાંધો યાતકરાર હોય તો મોત અથવા વકીલ મારફત સદરહું જાહેરાત પ્રસિધ્ધિની તારીખથી ૩૦ દિવસની અંદર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી ચીખલી, પ્રાંત કચેરી ચીખલી, જિ.નવસારીની કચેરીએ વાંધા રજુ કરવાના રહેશે. જેની લાગતા વળગતા ઇસમોએ નોંધ લેવી.

(મિતેશ પટેલ)

વાદીઃ **શ્રી અશોક્કુમાર મોહનલાલ પટેલ** નં.એમએજી/જ.મ.પ્ર./રજી.નં. ૩૫૩/૨૦૨ સબ ડીવીઝનલ મેજીસ્ટેટ ચીખલી કચેરી રહે. ૧૨-અ, અર્યોધયાનગર-૧બી, વિજલપોર, નવસારી. સામાવાળાઃ તલાટી કમ મંત્રીશ્રી, વાઘરેચ, તા. ગણદેવી, જીલ્લો નવસારી જિ. નવસારી. તા. ૦૮/૦૭/૨૦૨૫ જન્મ-મરણ અદિાનિયમ - ૧૯૬૯ ની કલમ ૧૩ (૩) અન્વયે જન્મ / મરણની નોંધ કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજી અન્વયે નોટીશ

પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, ચીખલી

આથી લાગતા-વળગતા ઈસમોને જણાવવાનું કે, વાદીએ જન્મ-મરણ અધિનિયમ હેઠળ અરજી કરેલ છે કે, અરજદારશ્રી અશોકકુમાર મોહનલાલ પટેલ, રહે. ૧૨-ઍ, અયોધ્યાનગર-૧બી, વિજલપોર, જિ. નવસારીનાઓએ તેઓના કાકાદાદા સ્વ. લાલાભાઈ ભગવાનભાઈ પટેલનું મરણ તા. ૧૯-૦૭-૧૯૬૬ ના રોજ મોજેઃ વાઘરેચ, તા. ગણદેવી, જી. નવસારી ખાતે થયેલ અને તેમના મરણની નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોઈ ભૂલ અને શરતચુકથી કરાવવાની રહી ગયેલી છે. જેથી અત્રેની કોર્ટમાં અરજ દાખલ કરેલ છે. સદર મરણની નોંધણી બાબતે કોઈને વાંધો યા તકરાર હોય તો પોતે અથવા વકીલ મારફત સદરહું જાહેરાત પ્રસિધ્ધિની તારીખથી ૩૦ દિવસની અંદર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી ચીખલી, પ્રાંત કચેરી ચીખલી, જી. નવસારીની કચેરીએ વાંધા રજુ કરવાના રહેશે. જેની લાગતા-વળગતા ફોર્ટનો સહી/- (મિતેશ પટેલ) સિક્કો સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ - ચીખ

સુરતમાં રવિવારે હાસ્ય કવિ સંમેલન યોજાયો સુરતઃ રવિવારે ૨૦ જુલાઇ ૨૦૨૫ના રોજ સાંજે ૭:૦૦ કલાકે પ્લેટિનમ

હોલ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે 'હાસ્ય કવિ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, ઇન્ડિયન ઈવેન્યુ સર્વિસના એડિશનલ ડિરેક્ટર જનરલ પંકજ દ્વિવેદી અને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વ્યસ્ત ઉદ્યોગ જગત અને નાગરિક જીવનશૈલી વચ્ચે હાસ્ય અને સાહિત્યના સ્પર્શથી તેઓને સુખદ અનુભવ કરાવવાનો છે. જીવનની દોડધામમાં થોડી પળો હાસ્યથી ભરેલી બનાવવા આ અનોખું આયોજન વિવિધ ક્ષેત્રના લોકપ્રિય હાસ્યકવિઓની હાજરીમાં આનંદ આપશે.આ હાસ્ય કવિ સંમેલનમાં દેશભરના જાણીતા હાસ્યકવિઓ અલીગઢના ડો. વિષ્ણુ સકસેના, જોનપુરના શશિકાંત યાદવ, ભોપાલના ડો.અનુ સપન, દિલ્હીના સુંદિપ ભોલા, મુંબઇના સેવા દિનેશ બાવરા અને કવયિત્રી અંકિતા સિંહ વિવિધ જોકસ, શેરો શાયરી તેમજ વિશે પણ જાહેરાત તાજી ઘટનાઓ પર હાસ્યના વ્યંગ થકી સુરતના ઉદ્યોગ સાહસિકો અને નાગરિકોને હસાવશે.

વેચાણ અંગેની જાહેર નોટિસ

આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે સુરત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ ચોર્યાસીના શહેર સુરતના મોજ ગામ કતારગામ વિસ્તારમાં ના રે.સ.નં. ૪૯૩ થી નોંધાયેલી જોનાના વિહાર સોસાયટીનુ આયોજન કરવામાં આવેલ છે તેમાં પાડવામાં આવેલ ખેતાં પાડવામાં આવેલ ખેતાં પાડવામાં આવેલ ખેતાં પાડવામાં આવેલ ખેતાં પાડવામાં આવેલ જો રોકે બહો ન કે. ૬-૭ ઉપર બોલવામાં આવેલ "સોમનાથ એપાર્ટમેન્ટ" માંજા માળે આવેલ જેની તેમાં પાડવામાં આવેલ જો તેમાં પાડવામાં આવેલ ખેતાં તેમાં પાડવામાં આવેલ જેની સ્ત્રુનીની પાડવામાં આવેલ જેની સ્ત્રુનીની પાડવામાં આવેલ જેની સ્ત્રુનીની પાડવામાં આવેલ જેની સ્ત્રુનીની પાડવામાં અથેલ જમીનમાંના વાણ-વહેચાયેલ ફાળે પડતા હિસ્સા સહીત તથા તેને લાગતાં વળગતાં અંદરના તથા બહારના તમામ હકક, અધિકાર સહીત મિલકલ જેનો મુનીનીપાલ ટેનામેન્ટ નં. ૧૯એચ-૪૫-૯૩૫૭-૦૦૧ ચાલી આવેલ છે. સદર જમીનના માલીક શારીકાંત હીરાલાલ ભગત ચાલી આવેલ, ત્યારબાદ આજરોજ સદર મિલકતના (૧) શ્રી ધર્મેશભાઇ બાબુલાલ મોહનલાલ પંચાલ તથ (૨) શ્રી પુનિત મહેન્દ્રભાઇ પંચાલના માલીક, મુખત્યાર, કબજાના ભોગવેદાર હોવાનું તથા સદરકૃતિક સોખખ માર્કેટેબલ ટાઇટલવાળી હોવાનુ જણાવી, શાંત, ખાલી, પ્રત્યક્ષ કબજો ચાલી આવેલ છે. જેમાં શશીકાંત હીરાલાલ ભગત પાસેથી મોબતસંગભાઇ ચાજાભાઇ પઢીયારે વેચાણથી લીધેલ તે સદરહું મિલકતને ગતા અસલ વેચાણ કરાર પોડી કબજા રસીદ નોટરી દ્વારા નોંધાયેલ, અસલ કબજા સહીતનો વેચાણ કરાર બોલાવેલ/ગેરવલને થઇ ગયેલ હોવાનુ જણાવેલ છે. સદર મિલકત હમારા અસીલ ખરીદ કરવા માગતા હોય જેથી સદરહું મિલકતમાં કોઈપણ ચાલિત, કોઈપણ રાષ્ટ્રીયાણ કરાર બોલાવેલ/ગેરવલને થઇ ગયેલ હોવાનુ જણાવેલ છે. સદર મિલકત હમારા અસીલ ખર કોઈપણ નો કર કાર્યા કર્યા સાથે પાર્ટ સાથે પાર્ચ જો પાર્ચ પાર્ચ સાથે પાર્ચ જો પાર્ચ પાર્ચ થયા માં કર્ય ચાને જતો યાને વેત કરેલ છે તે ગણી મારા અસીલ સદરહું મિલકતનો વેચનાર પાસેથી કાયદેસરનો વેચાણ કરાર તથા તથા તથા માત્ર થાયદેસરની કાર્યવાહી કરે સદર મિલકત વેચાણ રાખલે માત્ર અસીલ સદરહું મિલકત અંગે ભવિષ્યમાં કોઇન કાઈપણ લો કોઈપણ લો કહેર જ તતા માત્ર હોય માને જતો યાને વેચ કરેલ છે તે ગણી માત્ર અસીલ સદરહું મિલકત અંગે ભવિષ્યમાં કોઇન કોઈપણનો કોઈપણનો કોઈપણનો કોઈપણનો કહેર કહે તે હતે.

ઓફીસ: - દ, પ્રથમ માળ ઓફીસ: - દ, પ્રથમ માળ શિવરંજની કોમ્પ્લેક્ષ, સિંગણપોર સર્કલ, કતારગામ, સુરત તો ખરીદનાર ના એડવોકેટ, મો. ૯૭૩૭૧ ૨૩૭૮૯

ગુજરાત રાજ્ય નુર્મદા જળસંપતી પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ વર્તમાન-પત્રની જાહેર નિવિદા નં.૦૧ સૅને ૨૦૨૫-૨૬ (એસ.કે.)

કાર્યપાલક ઇજનેરશ્રી, સુરત નહેર વિભાગ, બીજો માળ, સિંચાઇ ભવન, લુર્ડસ કોન્વેટ સ્કુલ બસસ્ટોપ પાસે, અઠવાલાઇન્સ, સુરત-૩૯૫૦૦૭. ફોન નં (૦૨૬૧૨૬૬૮૭૧૬) ની કચેરી તરફથી "Provide Consultancy Services for Satellite-Based Reappraisal of Cultural Command Area (CCA) Including Cropping Pattern Analysis, Crop Water Requirement and Water Accountability for Bardoli Sub-Division, Surat Irrigation Circle, Gujarat" બાબત ની કામગીરીનાં ભાવો મંગાવવામાં આવે છે. કોરા ભાવપત્રક તા. ૧૮/૦૭/૨૦૨૫ થી તા. ૦૧/૦૮/૨૦૨૫ સુધી નિયત ફી રૂ. ૯૦૦/- ભર્યેથી કચેરીના કામકાજના સમય દરમ્યાન આપવામાં આવશે. ભરેલ ભાવ બંધ પત્રકમાં સ્પીડ પોસ્ટ / રજી. પોસ્ટ મારફત તા. ૦૮/૦૮/૨૦૨૫ ના રોજ ૧૬.૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.

કોઇપણ ભાવપત્રકો સ્વીકારવા કે ન સ્વીકારવા તે અંગેના તમામ અબાધિત હકો કાર્યપાલક ઇજનેરશ્રી, સુરત નહેર વિભાગ, સુરતને રહેશે અને તેમનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે.

ક્રમાંકઃ માહિતી-સુરત/પરપ/૨૦૨૫

yia અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, ચીખલી વાદીઃ **શ્રી અશોક્કુમાર મોહનલાલ પટેલ**

સામાવાળાઃ તલાટી કમ મંત્રીશ્રી, વાઘરેચ, તા. ગણદેવી, જીલ્લો નવસારી જિ. નવસારી. તા. ૦૮/૦૭/૨૦૨૫

બશોકકુમાર મોહનલાલ પટેલ, રહે. ૧૨-ઍ, અયોધ્યાનગર-૧બી, વિજલપોર, જિ. નવસારીનાઓએ તેઓના કાકીદાદી સ્વ. નાનીબેન મંગાભાઈ પટેલનું મરણ તા. ૨૬-૦૭-૧૯૮૯ ના રોજ મોજેઃ વાઘરેચ, તા. ગણદેવી, જી. નવસારી ખાતે થયેલ અને તેમના મરણની નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોઈ ભૂલ અને શરતચુકથી કરાવવાની રહી ગયેલી છે જેથી અત્રેની કોર્ટમાં અરજ દાખલ કરેલ છે. સદર મરણની નોંધણી બાબતે કોઈને વાંધો યા તકરાર હોય તો પોતે અથવા વકીલ મારફત સદરહું જાહેરાત પ્રસિધ્ધિની તારીખથી ૩૦ દિવસની અંદર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી ચીખલી, પ્રાંત કચેરી ચીખલી, જી. નવસારીની કચેરીએ વાંધા રજુ કરવાના રહેશે. જેની લાગતા-વળગતા ઈસમોએ

નં.એમએજી/જ.મ્.પ્ર./૨જી.નં. ૩૫૫/૨૦૨ સબ ડીવીઝનલ મેજીસ્ટેટ ચીખલી કચેરી રહે. ૧૨-અ, અર્યોધયાનગર-૧બી, વિજલપોર, નવસારી.

જન્મ-મરણ અદિનિયમ - ૧૯૬૯ ની કલમ ૧૩ (૩) અન્વચે જન્મ / મરણની નોંધ કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજી અન્વચે નોટીશ આથી લાગતા-વળગતા ઈસમોને જણાવવાનું કે, વાદીએ જન્મ-મરણ અધિનિયમ હેઠળ અરજી કરેલ છે કે, અરજદારશ્રી

ફોર્ટનો સહી/- (મિતેશ પટેલ) સિક્કો સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ - ચીખ



Moving Every Mile With A Smile

THIS COMMUNICATION IS IMPORTANT AND REQUIRES YOUR IMMEDIATE ATTENTION

Date: 17/07/2025

CIN: L60232GJ2006PLC049224

Dear Shareholder(s),

Subject: Transfer of your Shares held in Maheshwari Logistics Limited ("the Company") pursuant to section 124(6) of the Companies act 2013, and Rules thereunder to Investor Education and Protection Fund (IEPF) Authority.

As per Section 124(5) of the Companies Act, 2013 ('the Act') read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ('the Rules') and subsequent amendment thereto, all unpaid and unclaimed dividends are required to be transferred by the Company to the Investor Education and Protection Fund ('IEPF') established by the Central Government, after expiry of seven years from the date of transfer to unpaid dividend account. The details of such unpaid / unclaimed dividend are regularly updated on the website of IEPF Authority at www.iepf.gov.in as well as on the Company's website. Reminders have been sent from time to time to the shareholders for claiming their un-encashed dividend.

As per Section 124(6) of the Act read with the Rules and subsequent amendment thereto, all shares in respect of which dividend has remained unpaid or unclaimed for seven consecutive years or more shall be transferred in favour of the demat account of the IEPF Authority. However, where there is a specific order of Court or Tribunal or Statutory Authority restraining any transfer of such shares and payment of dividend or where such shares are pledged or hypothecated under the provisions of the Depositories Act, 1996, the Company will not transfer such shares to the IEPF Authority.

As per our records, dividend amount(s) declared by Maheshwari Logistics Limited("the Company") for FY 2017-18 is/are unclaimed in respect of your equity shareholding in the Company. Details of such unclaimed dividend(s) are available on the website of the Company on www.mlpl.biz.

What are you required to do?

You are therefore, requested to claim the un-encashed dividends due to you by returning duly signed enclosed letter to Big share Services Private Limited, Registrar and Transfer Agent of the Company ('RTA'), on or before Wednesday, October 22, 2025 stating your Bank Account details along with:

In case shares are held in electronic form: Copy of the client master list is to be submitted. Payment will be made to the Bank Account registered against the demat account.

In case shares are held in physical form: Investor Service Request Form ISR - 1, Form ISR - 2 and Form No. SH 13 (Nomination Form) or Form ISR-3 (Opt out of

SUPPLIERS OF ALL TYPE OF COAL, COKE, LIGNITE, KRAFT PAPER & DUPLEX BOARD, FLEET OWNERS & TRANPORTS CONTRACTORS

MLL House, Shed No. A2-3/2, Opp. UPL, 1St Phase, GIDC, Vapi-396 195 (Guj.) Phone: +91 260 2431024 Fax: 2427024 E-mail: info@mlpl.biz Web: www.mlpl.biz



Moving Every Mile With A Smile

Nomination) duly filled as per the instructions stated therein along with the supporting documents including original cancelled cheque stating your name as the Account holder. The Investor Service Request Forms are available at the website of our RTA at: website https://www.bigshareonline.com \rightarrow Services \rightarrow Investor Resources \rightarrow Downloads \rightarrow Forms \rightarrow Formats for KYC.

As per SEBI norms outstanding payments will be credited directly to the bank account if the folio is KYC Compliant. Payment can be made to shareholders holding shares in physical form if the folio is KYC compliant.

What happens if you do not claim the dividend(s) due to you by 22nd October, 2025?

Please note that in case the dividend(s) are not claimed by **Wednesday**, 22nd **October**, 2025 those equity share(s) in respect of which the dividend(s) remains unclaimed shall be transferred in Favor of IEPF Authority in the following manner in accordance with the provisions of the Act and the rules.

In case the shares are held by you:

- In physical form new share certificate(s) will be issued and transferred in favour of IEPF Authority on completion of necessary formalities. Hence, the original share certificate(s) which stand registered in your name will be deemed cancelled and non-negotiable.
- In dematerialized form the Company shall inform the depository by way of corporate action for transfer of shares lying in your demat account in favour of IEPF Authority.

Please note that, pursuant to the notifications issued by the Ministry of Corporate Affairs (MCA) from time to time, the Company shall transfer the equity shares to IEPF without any further notice to you and the Company shall not be liable for any claim in respect of the equity shares so transferred.

How can you claim the dividend(s)/Equity Share(s) transferred to IEPF?

Should your unclaimed dividend(s)/Equity Share(s) be transferred in favor of the IEPF Authority, the same can be claimed by you by making an online application electronically (web form IEPF-5) available on the website of the Ministry of Corporate Affairs at www.iepf.gov.in and sending physical copy of the same, duly signed, to the attention of the Nodal Officer/Deputy Nodal Officer, Maheshwari Logistics Limited, MLL House, A2-3/2 Opp. UPL 1st Phase, GIDC, Vapi, Valsad-396195, Gujarat, India, along with the e-form IEPF-5 submission acknowledgement/challan and requisite documents enumerated in web form IEPF - 5. Please note that the link to the web form is also available on the website of the Company at https://www.mlpl.biz/shareholders-information.html.

SUPPLIERS OF ALL TYPE OF COAL, COKE, LIGNITE, KRAFT PAPER & DUPLEX BOARD, FLEET OWNERS & TRANPORTS CONTRACTORS

MLL House, Shed No. A2-3/2, Opp. UPL, 1St Phase, GIDC, Vapi-396 195 (Guj.) Phone: +91 260 2431024 Fax: 2427024

E-mail: info@mlpl.biz Web: www.mlpl.biz CIN: L60232GJ2006PLC049224



Moving Every Mile With A Smile

Whom should you contact for information, assistance or clarifications?

Should you need any further information or have any further questions or need any assistance in this regard, please contact either of the following:

COMPANY CONTACT DETAILS	RTA CONTACT DETAILS					
Mr. Gaurav Rajesh Jhunjhunwala	Bigshare Services Private Limited					
Company Secretary & Compliance	Address: Office No. S6-2, 6th Floor,					
Officer	Pinnacle Business Park, next to Ahura					
Maheshwari Logistics Limited	Centre, Mahakali Caves Road, Andheri					
Address: MLL House, A2-3/2 Opp. UPL	(East) Mumbai- 400093, Maharashtra,					
1st Phase, GIDC, Vapi, Valsad-396195,	India					
Gujarat, India	Phone: 022–62638200					
Tel. No.: +91 260 2431024/	Email: lawoo@bigshareonline.com /					
8155000688	investor@bigshareonline.com					
Email: cs@mlpl.biz						

For Maheshwari Logistics Limited

Gaurav Rajesh Jhunjhunwala

Company Secretary & Compliance Officer Maheshwari Logistics Limited

SUPPLIERS OF ALL TYPE OF COAL, COKE, LIGNITE, KRAFT PAPER & DUPLEX BOARD, FLEET OWNERS & TRANPORTS CONTRACTORS

MLL House, Shed No. A2-3/2, Opp. UPL, 1St Phase, GIDC, Vapi-396 195 (Guj.) Phone: +91 260 2431024 Fax: 2427024 E-mail: info@mlpl.biz Web: www.mlpl.biz CIN: L60232GJ2006PLC049224

To,

BIGSHARE SERVICES PRIVATE LIMITED

(CIN: U99999MH1994PTC076534)

Unit: MAHESHWARI LOGISTICS LIMITED

Office No. S6-2, 6th Floor, Pinnacle Business Park,

next to Ahura Centre, Mahakali Caves Road,

Andheri (East) Mumbai- 400093, Maharashtra, India

Dear Sir/Madam,

Subject: Request for payment of Unpaid / Unclaimed Dividend(s)

This has reference to your communication dated July 17, 2025. Kindly arrange for payment of unpaid/unclaimed dividend(s) as mentioned below on the basis of this advice.

(Tick ✓ whichever is applicable)

I enclose	the original	instrument(s)	as per the	particulars	given below

☐ I do not possess the original instrument(s).

I confirm that I have not sold / pledged my shares and continue to be the legal owner of shares held in the below mentioned account. I have also not encashed any of the instrument(s) sent to me earlier, nor have I received any money in connection with the payment(s) mentioned below:

Folio No. / DP-Client ID: IN30048411762259

Warrant No.	Net Amount (Rs)	Date of Payment	Claim before
		15.10.2018	22 nd October, 2025
			22 nd October, 2025

For shareholders holding shares in physical form: I request you to update my KYC Details/ Bank Details & Nomination, as given below & stated in enclosed Form ISR - 1, Form ISR - 2 & SH - 13 against the above folio and accordingly, I am enclosing self-attested documents, being the documentary evidence of Identity and Address [please tick ✓ below].

\Box Self-Attested of older than 3 more	nths)	adhaar Card/ Latest	Utility Bill (should not be
	est Form (ISR):		reholder(s) (for physical
holdings)	ched cheque bearing	the hame of the sha	remolder(s) (for physical
☐ Any Other: Ple	ease specify		
Bank Name:		Branch Name	:
A/c Type:	A/c No.:	MICR:	IFSC:
New Address:			

For sha	res	held	in	Electi	ronic/	Demat	terialized	Form:	New	Bank	Details	are
registere	d ag	ainst	my	A/c. I	am en	closing	[please ti	ck √ be	low].			
□ Self-Adetails re							List featu t.	ring my	new	addres	ss and b	ank
Place: Date:												
Email Id												
Contact	No.:											

Signature of the first named Shareholder

Please note that in the absence of complete bank details registered against your account with RTA / Depository Participant, payment of outstanding dividend amount cannot be effected. Payment will be made only to KYC Compliant Shareholders.